

78 78 5 91 0 92 પર GK લખી વોટ્સેપ પર સેન્ડ કરો.

Current affairs 354 (1) સામાન્ય જ્ઞાન 7-2-2017

Page-1

રાષ્ટ્રીય

- ૧) ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ નાશિક શહેર દ્રાક્ષ ઉત્પાદન સારું ઘરાવે છે, હાલ તે દેશની વાઈન રાજધાની બની રહી છે.
- ૨) સી.બી.એસ.ઈ. એક એપ તૈયાર કરી રહ્યું છે, તેની એક કિલક પર વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર અને અંતર તથા માર્ગ બતાવશે.
- ૩) તાજેતરમાં તમિલનાડુના મુખ્યમંત્રી પનીરસેલ્વમે રાજીનામું આપી દીધેલ છે, તેની જગ્યાએ શશીકલા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
- ૪) આજે 7 ફેબ્રુઆરીના રોજ બિહાર વિધાનસભાનો સ્થાપના દિન ઉજવવામાં આવશે.
- ૫) 9 ફેબ્રુઆરી 2017 ના રોજ ભારતમાં રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિનનું આયોજન કરવામાં આવશે.
- ૬) 10 ફેબ્રુઆરી 2017 ના રોજ દિલ્હી ખાતે 15 માં લીટરેચર ફેસ્ટીવલનો પ્રારંભ કરવામાં

આવશે.

- ૭) 11 ફેબ્રુઆરી 2017 ના રોજ પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ સમર્પણ દિવસ તરીકે ઉજવવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય

- ૮) વિશ્વના સૌથી લાંબા અંતરની ફ્લાઈટ કતાર એરવેઝના વિમાને દોહાથી ઉડાન ભરેલ છે, આ વિમાન 10 ટાઈમ ઝોન માંથી પસાર થશે, અને 14,500 કિલોમીટરનું અંતર કાપશે.
- ૯) પાકિસ્તાનના પ્રખ્યાત નાટ્યકાર અને સાહિત્યકાર બાનો કુદસિયાનું 88 વર્ષની વયે અવસાન થયેલ છે.
- ૧૦) 8 ફેબ્રુઆરી 2017 ના રોજ ન્યુક્લીયર સુરક્ષા અંગે આંતરરાષ્ટ્રીય બેઠક યોજાશે.
- ૧૧) ઈન્ડોનેશિયામાં અચામ સેમાની નામના કૂકડાની પ્રજાતિ વિકસાવવામાં આવી છે, તેની વિશેષતા એ છે કે તેની પાંખ, આંખો, અંગ, જીભ, અને લોહીનો રંગ પાણ કાળો છે.

7-2-2017

૧૨) અમેરિકાના ટેક્સાસ સ્થિત હ્યુસ્ટન મેથોડીસ્ટ હોસ્પિટલે એક માઈક્રો ટ્રાન્સકેથેટર પેસિંગ સીસ્ટમ વિકસાવેલ છે, જે વિશ્વનું સૌથી નાનું પેસમેકર છે.

રમત-જગત

૧૩) બ્લાઈન્ડ ટી-૨૦ માં ઓસ્ટ્રેલીયા સામે ભારતનો ૧૨૮ રને વિજય થયેલ છે.

૧૪) આગામી ૧૨ મી ફેબ્રુઆરી ૨૦૧૭ ના રોજ બેંગલુરુ ખાતે અંધજનોની ટી-૨૦ ક્રિકેટ વર્લ્ડકપ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ યોજાશે, ગયા વર્ષે ભારત આ મેચમાં વિશ્વ વિજેતા બન્યું હતું.

૧૫) જુન ૨૦૧૭ માં ઈંગ્લેન્ડમાં યોજાનાર ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા તમામ ક્રિકેટરોના ડોપ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવશે.

૧૬) હાલ રમાઈ રહેલ લા લીગા શીપમાં મેસ્સીએ બર્સોલના તરફથી ફી કિક દ્વારા સૌથી વધારે ગોલ કરવાનો રેકોર્ડ નોંધાવેલ છે.

૧૭) તાજેતરમાં ભારતે મલેશિયાને એશિયન

જુનિયર સ્કવોશ ચેમ્પિયનશીપમાં ૨-૦ થી હરાવી ગોલ્ડમેડલ જીતી લીધેલ છે.

અન્ય

૧૮) હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ લાખથી વધારે રોકડ લેણ-દેણ પર ૧૦૦ ટકા લગાવવાનો નિયમ જાહેર કરેલ છે.

૧૯) ૪ ફેબ્રુઆરી ૨૦૧૭ ના રોજ મનાવાયેલા વિશ્વ કેન્સર દિવસની થીમ રાખવામાં આવી હતી, હમ કર સકતે હૈ, મૈ કર સકતા હું.

૨૦) દિવ્યાંગ ખેલાડીઓ માટે ભારતના ગુજરાત રાજ્યમાં પ્રથમ ઉત્કૃષ્ટતા કેન્દ્રની સ્થાપના થયેલી છે.

7-2-2017

સમીક્ષા 191(1) તારીખ 7/2/2017

ભારતના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા 6 રાજ્યોમાં અટલ મિશન યોજનાઓને મંજૂરી આપવામાં આવી...

- ૧) શહેરી વિકાસ મંત્રાલય દ્વારા અટલ કાયાકલ્પ અને શહેરી રૂપાંતરણ મિશન (અમૃત) અંતર્ગત 2017 થી 2020 સુધીમાં બુનિયાદી શહેરના ઢાંચાને બહેતરીન બનાવવા માટે 6 રાજ્યોમાં રોકાણની મંજૂરી પ્રદાન કરવામાં આવી છે.
- ૨) આ છ રાજ્યોમાં આવનાર 42 શહેરોમાં 1432 કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાયતા પ્રદાન કરવામાં આવશે.
- ૩) આ સહાયતા સાથે 2863 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.
- ૪) આ યોજના અંતર્ગત શહેરોના તમામ આવાસોને નળના માધ્યમથી જોડવામાં આવશે, ગટર વ્યવસ્થા પણ લાગુ કરવામાં આવશે.
- ૫) અમૃત યોજના અનુસંધાને ઝારખંડમાં સાત શહેરોને આવરી લેવામાં આવેલ છે.
- ૬) કર્ણાટક રાજ્યમાં 955 કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાયતા મંજૂર કરવામાં આવેલ છે.
- ૭) હિમાચલ પ્રદેશ રાજ્યને કેન્દ્ર સરકાર દ્વારા 103 કરોડ રૂપિયાની સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

– પરેશ ચાવડા

7-2-2017

રોજે- રોજ આપના ફોનમાં જુકે, કરંટ અફેર્સ મેળવવા નીચેની લીંક પરથી એપ ડાઉનલોડ કરો.

<https://play.google.com/store/apps/details?id=com.edusafar>

વિડીયો ઘોરણ 10 પ્રકરણ 15 ના મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન વિડીયો જુઓ નીચેની લિંક પરથી

<https://www.youtube.com/watch?v=OtAHBi2eUYw>

ગણિત સાદું વ્યાજ વિડીયો-4. માટે નીચેની લિંક ઓપન કરો.

<https://www.youtube.com/watch?v=v9uCYOeeN6A>

28 થી 31 જાન્યુઆરી કરંટ અફેર્સનો ગુજરાતી વિડીયો નીચેની લિંક પરથી જુઓ

<https://www.youtube.com/watch?v=4lmDCO8C4-Y>

બેસ્ટ જુકે વિડીયો માટે નીચેની લીંક ઓપન કરો.

https://www.youtube.com/channel/UCfDAM9P2RF_ynz8B_j5enC

મિત્રો, એજ્યુસફર દ્વારા GK ના વિડીયો અપલોડ કરવામાં આવ્યા છે આ માટે

YouTube પર જઈ, **EduSafar** લખી સર્ચ કરી, ચેનલ સબસ્ક્રાઈબ કરશો જેથી

GK વિડીયો ના નવા અપડેટ્સ મેઈલ પર મળતા રહેશે.